

TYBA - Sem - 6 ડાયરી નંબર - 99 81 22

647510 + Compulsory — BA06SanC017x Hindi + Seat No : English

B.A. Semester - 6 (CBCS) Examination

April/May-2022 (NEW COURSE)

SAN P17 Sankhay Darshan (Core -17 (New))

OK ✓

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

प्रश्न-१	नीयेनामांथी कोईपाण बे कारिकानो अनुवाद करी, समजावो. Translate and explain of any two karikas of the following.	(१४)
	१. भूलप्रकृतिविकृतिर्महदाद्या: प्रकृतिर्विकृतयः सप्त। षोडशकस्तु विकारो न प्रकृतिर्विकृतिः पुरुषः॥ २. अतिदूसत् सामीप्यात् इन्द्रियधातान्मनोडनवस्थानात्। सौक्ष्याद् व्यवधानाद् अभिभवात् समानाभिहाराश्च॥ ३. करणं त्रयोदशविद्यं तदाहरणधारणप्रकाशकरम्। कार्यं च तस्य दशधाडहार्याद्धार्यं प्रकाशयं च॥ ४. वत्सविवृद्धिनिमितं क्षीरस्य यथा प्रवृत्तिरज्ञस्य। पुरुषविमोक्षनिमितं तथा प्रवृत्तिः प्रधानस्य॥	
प्रश्न-२	सांख्यदर्शननी सांख्यचार्य परंपरा विशे माहिती आપो. Give the Information about 'सांख्यचार्य परंपरा' of sankhya philosophy.	(१४)
	अथवा/OR	
प्रश्न-२	सांख्यदर्शनना मुख्य सिद्धांतोनी चर्चा करो. Discuss the Main Principles of सांख्यदर्शन.	
प्रश्न-३	सांख्यना मतानुसार 'सत्कार्यवाद' समजावो. Explain 'सत् कार्यवाद' according to sankhya.	(१४)
	अथवा/OR	
प्रश्न-३	सांख्यदर्शन अनुसार 'प्रमाणविचार' समजावो. Explain according to 'प्रमाणविचार' sankhya philosophy.	
प्रश्न-४	सांख्यदर्शन मतानुसार मोक्षविचार (कैवल्यम) समजावो. Explain 'मोक्षविचार (कैवल्यम)' according to sankhya philosophy.	(१४)
	अथवा/OR	
प्रश्न-४	सांख्यदर्शन मतानुसार पुरुष अने पुरुषबहुत्व विचारने विगते चर्चा. Explain पुरुष and पुरुषबहुत्व according to sankhya philosophy.	
प्रश्न-५	नीयेनामांथी कोईपाण बे टूंकनोध लघो. Write a short note on any two of the following.	(१४)

	१. षाढस्तु विकारः। २. अष्टधासिद्धिः। ३. गुणत्रयम्। ४. इश्वरकृष्णास्य जीवनम्।	

B.A. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)

SAN P18 Introduction of Linguistics-2 (Core -18 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

प्रश्न-१	ધ्वनि परिवर्तनानां કारणો વિસ્તારથી સમજાવો. Explain in detail the causes of phonetic changes.	(14) અથવા/OR
प्रश्न-१	વ્યંજન ધ્વનિઓના વિકાસની ચર્ચા કરો. Discuss the consonants of sound's development.	(14)
प્રશ્ન-૨	શબ્દ અને પદ વચ્ચેનો તફાવત વિસ્તારથી સ્પષ્ટ કરો. Explain in detail the difference of 'શબ્દ' અને 'પદમ्'. અથવા/OR	(14)
પ્રશ્ન-૨	પદ પરિવર્તનના કારણોની વિસ્તૃત ચર્ચા કરો. Explain in detail the reasons of 'पदपरिवर्तनम्'.	(14)
પ્રશ્ન-૩	પદોના વર્ગીકરણ પર સંવિસ્તર નોંધ લખો. Write a detailed note on classification of morphemes.	(14) અથવા/OR
પ્રશ્ન-૩	સંસ્કૃત ધ્વનિઓની સંધ્યાત્મક વિશેષતાઓની સંવિસ્તાર નોંધ લખો. Write a detailed note on prosodic classification.	(14)
પ્રશ્ન-૪	પદપરિવર્તન અને ધ્વનિ પરિવર્તન વચ્ચેનો ભેદ વિસ્તારથી ચર્ચા. Discuss fully difference between 'पदપરિવર્તનમ्' અને 'ध્વનિપરિવર્તનમ्'. અથવા/OR	(14)
પ્રશ્ન-૪	સંઘંધતત્ત્વનાં પ્રકારોની ચર્ચા કરો. Discuss the types of 'SAMBANDH TATTVA'	(14)
પ્રશ્ન-૫	નીચેનામાંથી કોઈપણ બે પર ટૂંકનોંધ લખો. Write short-notes any two of the following.	(14)
	1. ભાષામાં નવા શબ્દોનું આગાન The reasons of introduction of new-words. 2. લિંગ, વયન અને વિભક્તિ. Sign, number and case 3. બલાધાતા। 4. અપશ્રુતિ।	

B.A. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)
SAN P19 Aarthshastra (Core -19 (New))

Time: 2:30 Hours

Marks: 70**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

प्रश्न-१**नीयेनामांधि कोई पछा बे पर नोंध लघो.****(१४)****Write in detail any two of the following:**

१. चतस्र एव विद्या इति कौटिल्यः। ताभिर्धमर्थै यद् विद्यातदविद्यानां विद्यात्वम्।
यद् विद्यातदविद्यानां विद्यानां विद्यात्वम्।
२. कृषिपशुपाल्ये वाणिज्या च वार्ता। धान्यपशु हिरण्यकुप्यविष्टिपेअदानादौपकारिकी। तया स्वपक्षं परपक्षं च वर्शकरोति कोशादण्डाभ्याम्।
३. कृत्स्नं हि शास्त्रमिदमिन्द्रयजयः।
४. पुत्ररक्षणं जन्मप्रभृति राजपुत्रान् रक्षेत्।
कर्कटसधर्माणो हि जनकभक्षा राजपुत्राः।

प्रश्न-२**भारतीय राजनीतिनो उद्भव अने विकास वर्णवो.****(१४)****Describe the origin nature and development of Indian politics.****अथवा/OR****प्रश्न-२****कौटिल्य अर्थशास्त्रनां कर्तनो परिचय आपीने अर्थशास्त्रनुं विषयवस्तु जडावो.****Who is creator of 'कौटिल्य अर्थशास्त्रम्' explain, write critical notes on subject theme of अर्थशास्त्रम्****प्रश्न-३****कौटिल्यना अर्थशास्त्रनो शैली पर नोंध लघो.****(१४)****Write a detailed note on the style of the कौटिल्यस्यार्थशास्त्रः।****अथवा/OR****प्रश्न-३****संस्कृत साहित्यमां कौटिल्य अर्थशास्त्रनुं महत्व अने प्रदान दर्शावो.****Describe the contribution and importance of कौटिल्य-अर्थशास्त्र in Sanskrit literature.****प्रश्न-४****कौटिल्यना अर्थशास्त्रमां निरूपित राजचर्चने विगते समजावो.****(१४)****Explain fully the described राजचर्चा in the 'कौटिल्य-अर्थशास्त्र'.****अथवा/OR****प्रश्न-४****कौटिल्यना अर्थशास्त्रमां 'दंडनीति' अंगेना जुदा जुदा सूतिकारोना विचारो वर्णवो.****प्रश्न-५****नीयेनामांधि कोई पछा बे पर विवरणात्मक नोंध लघो.****(१४)****Write critical notes on any two of the following:**

१. विद्यासमुद्देशः।
२. पुरोहितः।
३. गुप्तचरः।
४. उपधाभिः।

B.A. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)
SAN P20 Philosophy-2 (Core -20 (New))

Time: 2:30 Hours

Marks: 70**Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

प्रश्न-१(अ) नीरेनामांथी कोईपछा ऐ श्लोकोनी आवश्यक विवरण साथे अनुवाद करो:

(०८)

Que-1(A) Translate the following any two shlokas with necessary explanation.

(08)

1. वेदानां सामवेदोऽस्मि देवानामस्मि वासवः।
इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना॥
2. न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा।
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम्॥
3. इदं शरीरं कौन्तेय क्षेत्रमित्य भिर्धीयते।
एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः॥
4. उर्ध्वं हच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः।
जद्यन्यगुनवृत्तिस्या अधो गच्छन्ति तामसाः॥

प्रश्न-१(ब) नीरेनामांथी कोईपछा ऐ श्लोकोनी पूर्ति करो.

(०६)

Que-1(B) Fill up any 'two' of the following verses:

(06)

1. अद्वैष्टा सर्वभूतानां.....सुखःक्षमी।
2. समः शत्रौ.....सङ्घाविवर्जितः।
3. उर्ध्वमूलमध्यः.....वेद स वेदवित्।
4. ममैवांशो जीवलोके.....कर्षति।

प्रश्न-२ श्रीमद्भगवद्गीता अने ब्रह्मसूत्र वर्णनो संबंध स्पष्ट करो.

(१४)

Clarify the relationship between 'श्रीमद्भगवद्गीता' and 'ब्रह्मसूत्र'.

अथवा/OR

प्रश्न-२ 'उपनिषद्' शब्दनो अर्थ स्पष्ट करी, 'उपनिषद्' नां मुख्य सिध्धांतो वर्णवो.

Explain the term 'उपनिषद्' and discuss the main Principles of 'उपनिषद्'.

प्रश्न-३ विभूतियोगः (अध्याय-१०) नो सारांश आपी, गीतामां तेनुं महत्व समजावो.

(१४)

Summarize the विभूतियोगः (अध्याय-१०)

अथवा/OR

प्रश्न-३ श्रीमद्भगवद्गीता अध्याय-१६ (दैवासुरसंपद विभाग योगः) नो सारांश आपी, गीतामां तेनुं महत्व समजावो.

Give the summary of श्रीमद्भगवद्गीता- अध्याय-१६ (दैवासुरसंपद विभाग योगः) and explain its importance in Geeta.

प्रश्न-४ 'गीता ज्ञवन ज्ञवानी क्वा शीघ्रे छ'- आ विधाननी यर्या करो.

(१४)

'The Geeta teachers the art of living life' discuss the Statement elaborately.

अथवा/OR

प्रश्न-४ भगवद्भक्तनां लक्षणो आपी, भक्तियोग विशेष समजावो.

Describe the explain about भक्तियोगः by giving features the Bhagvat bhakt.

प्रश्न-५ नीरेनामांथी कोईपछा ऐ पर विस्तृत नोध लघोः

(१४)

Write notes in detail on any two of the following:

1. क्षेत्र-क्षेत्रज्ञ।
2. गुणत्रयम्।
3. विश्वरूप दर्शन योगः।
4. नष्टे मोहः स्मृतिर्लब्धा।

B.A. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)

SAN P21 Sanskrit Language and Literature-2 (Core -21 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

प्रश्न-१(अ) नीरेनामांधी कोईपाण ऐ क्षोक नु भाषांतर करो।

(०६)

Translate any two of the following.

1. तस्य स्थित्वा कथमपि पुरः कौतुकाधान हतो तन्तर्बाष्यज्जिरमनुचरो राजराजस्य दृष्ट्यै।
मेधालोके भवति सुखिनीडप्यन्यथीवृति चेतः कण्णश्लेषप्रपिनि जने किं पुनर्दूरसंस्थे॥
2. अद्रेः शृङ्गं हरित पवन किञ्चिदित्युन्मुखीभीः दृष्टसाहश्कितचकित मुग्धसिइभाइनाभिः।
स्थानात्स्मांत्सरं सनिचुलाद्यतोद्भुतमुखः खं दृडनागानां यथि परिहरन्स्थूलहस्तावलेपान्॥
3. गत्वा च उध्वं दृशमुखमुजोच्छवासित पुरुषसंधे: कलासस्य त्रिदृशनिता दर्पणस्यातिथिः स्याः।
रदडाच्छायै कुमुदविशदैयी सितत्पस्थितः राशीभूतः प्रतिदिनमिव अम्बकस्याद्वहासः॥
4. पाण्डुच्छायीपवनवृतपः केतकैः सूचिभिन्नै नीहारभैर्गृहबलिभुशामा कुलग्रामकैथाः।
त्यासन्न परिपतकल श्यामज्मुवतान्ताः संपत्स्पन्ते कतिपयदिनस्थापिहंसा दर्शापाः॥

प्रश्न-१(भ) पूर्वापर संदर्भ मापी समजावो। (कोईपाण ऐ)

(०६)

Explain with reference to the context (any two)

1. कामार्ता हि प्रकृतिकृपयाश्वेतनाचेतेनेषु।
2. न्के वा न स्युः परिभव पदं निष्ललारम्भयलाः।
3. वप्रकीडापरिपतगजप्रेक्षपीयं ददर्श।
4. श्यामःपादो बलिनियमनाभ्युद्यतस्यै विष्योः॥

प्रश्न-२ कालिदासना ज्ञवन समय अने कृपन विशे विस्तृत माहिती आपो।

(१४)

Write critical note in detail on life time and work of kalidas.

अथवा/OR

प्रश्न-२ कालिदासनी शैली वर्णवो।

Explain the style of kalidas.

प्रश्न-३ नीरेनामांधी कोईपाण ऐक पर संस्कृतमां निबंध लघो।

(१४)

Write eassy in Sanskrit ant one of the following.

1. यत्रानार्यस्तु पुजयन्ते।
2. संधे शक्तिः कलौयुगो।

प्रश्न-४ नीरेनामांधी कोईपाण ऐ छंद उदाहरण साथे समजावो।

(१४)

Explain any two meters from the following with example.

1. महाकान्ता।
2. शिखरिणी।
3. पृथ्वी।
4. अनुष्टुप।

પ્રશ્ન-પદ્ધતિ

નીચેનામાંથી કોઈપણ એક સંસ્કૃત ગ્રથખંડનો અનુવાદ કરો.

(07)

Translate any one of the following passages in to Gujarati.

1. પરમેશ્વરણ જગતિ સમૃથાદિતેષુ સર્વ દવ્યેષુ વિધૈવ સર્વશ્રેષ્ઠ દ્રવ્યમ। વિદ્યાવિહિન: માનવ: મૂર્ખ: કથ્તે। અત એવ વિદ્યાધનસ્ય સર્વેતર ધનભ્ય: પ્રથાનો ઉકતા કવિભી:। વિદ્યાવન્ત સર્વેત્ર પ્રતિષ્ઠા લાભન્તા। એતદ્વારા વિદ્યા કિયાન્તિતા ન ભવતિ સા ખલવનથૈવૈ ફલપતે। ચ: કિયાવાન્ સદાબાર સપન્ન: સ એવ વિદ્ધાનં કથ્યેતા। વિદ્યામધીષુના સુખદુઃખે મનસાપિ ન ચિન્તનીતે। અવિશ્રાન્ત શ્રમમનવરતેન ગુરૂપા વિતરિતા વિદ્યા સર્વાત્મના આત્મસાલ્કરપીયા।
2. માનવજીવનં સુદુર્લભ વર્તત ઇત્યર્થબાહુલયે તૃથ્યમ। શ્વાસચ્છવાસ ગ્રહ્યમાત્રમેવ ન જીવન કાર્યાસિ। અસ્તિત્વ રક્ષણમેવ કેવલં ન જીવનમા। અન્યેષા વિલિનીકરપમ કૃત્વા। જીવનીયમિત્ત્યપિ ન જીવનમા। ઈશ્વર પ્રદૂતપ્રાંમા ધારેણ સર્વેદ્વપિ જીવા એકથા અન્યથા વા જીવનં યાપ યન્નૈવ કિન્તુ પશુનામપેક્ષી મનુષ્ણે જડતોયાર: સમુચ્છેદ: સવિશેષ કૃત ઇતિ તદેશ સલાક્ય પશુનામ પેક્ષયા ગૂળેષુ ચ કર્મસુ ચ મનુષ્યો ન સંવૃત ઇત્ય તસ્ય પશો: પરં સ્થાપયિતુ ન સુશકમા।

પ્રશ્ન-પદ્ધતિ

નીચેનામાંથી કોઈપણ એકનો સંસ્કૃતમાં અનુવાદ કરો.

(07)

Translate of the any one in to Sanskrit

1. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે અનુભવ દરેક વસ્તુ શીખવતો નથી તે ઈતિહાસ ભૂગોળ જે રસાયણશાસ્ત્ર શીખવતો નથી તે જે શીખવે છે તે જીવન જીવવાની કલા આ અનુભવ જેટલી સારી રીતે બીજુ કોઈ શીખવી શકતું નથી. અનુભવ એ કડક શીક્ષક છે અને તે બહુ આકરી વસ્તુલ કરે છે તે ભૂલોની બહુ કઠોર શિક્ષા કરે છે પરંતુ તે પોતાના પાઠ સંપૂર્ણ પણ શીખવે છે.
2. Experience is the best teacher it doesn't teach everything. It doesn't teach history geography or chemistry. What it teaches is the art of living. Nothing else can teach this subject as good as experience does. Experience is a strict teacher and it charges very high fees. It teaches its lessons thoroughly.
3. મહાભારતનું યુધ્ય આરંભાયુ છે રણાંગણમાં સામસામી સેના ગોઠવાઈ છે. અર્જુને શ્રીકૃષ્ણ ને કહ્યું કે 'મારો રથ બદ્ધે સેના વચ્ચે લાવી મુકો. રથ માંથી દ્રાષ્ટિપાત કરતા અર્જુન બદ્ધે બાજુએ સગાયો, મિનો અને વડીલોને જોયા. તેને વિદ્યાદ ધરી વખ્યો એ બોલી 'ઉઠ્યો' મારા ઝવાડા ઝડા થાય છે "શ્રી ઢીલા પડે છે મારાથી યડી નહિ શકાય". મા શબ્દો સાથે વેણે ગાંડીવ ધનુષ મુકી દીધુ ત્યારે ગવાની અનુભવતા અર્જુનને ફૃષ્ટે ઉપેદ્ધ માય્યો.
4. Mahabharat was already begun. The opposing armies have been arranged on the battle field. Arjun told Krishna to park his chariot in the middle of the two armies. Taking a view from the chariod Arjun saw on both the sides his kinsman. Friends and Elders. He was overpowered with sorrow. He came out with an utterance. My lims fail me, my body sweats and get horripilation. I am unable to fight with these words he threw away his Gandiv Bow. Krishna preached a sermon to Arjun who was this dejected.

B.A. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)
SAN P22 Vedic Literature (Core -22 (New))

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

प्रश्न-१ नीयेनामांथी कोईपछा बे मंत्रोनो अनुवाद साथे समजावो। (१४)

Translate with explain any two of the following.

१. विश्वंभरा वसुधानी प्रतिष्ठा हिरण्यवक्षा जगतो निवेशनी।
वैश्वनरं बिभ्रती भूमिरग्रिमिन्द्रकषभा ट्रविणे नो दधातु।
२. यस्यां वेदि परिगृहणन्ति भूम्यां यस्यां यज्ञं लन्वते विश्व कर्मणः।
यस्यां मीयन्ते स्वखः पृथिव्याभूर्धर्वा शुक्रा आहुत्वाः पुरस्ततं॥
३. यत् पर्जन्य कतिन्द्रत स्तनयन हंसि दुष्कृतः।
प्रतीदं विश्व भादेते यक्षिच्चिपृथिव्यामधि॥
४. अक्षैर्मा दीव्यः कृषिमिलृष्टस्व विते रमस्व बहु मन्यमानः।
तत्र गावः कितव तत्र जाया तन्मे विचेष्ट सवितायमर्य॥

प्रश्न-२ नीयेनामांथी कोईपछा बे मंत्रोने अनुवाद साथे समजावो। (१४)

Translate with explain any two of the following.

१. ऊं पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पुर्णमादाय पुर्णमेवा शिष्यते॥
२. असुर्या नाम ते लोका अन्धेन तमसाडवृता।
तांस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः॥
३. विद्यां याविद्यां च यस्यद्वेदोभयं सह।
अविद्यया मृत्युं तीत्वा विद्यायाडमृतमरनु ते॥
४. हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्।
तत्वं पूषन्पावृणु सत्यधर्माय दृष्ट्ये॥

प्रश्न-३ भूमिसूक्त नुं रसदर्शन करो। (१४)

Whole discuss of भूमिसूक्तः

अथवा/OR

वैदिक संहिताओमां अर्थवेदनुं स्थान समजावो।

Importance of 'अर्थवेद' in vaidik sanhita.

ईशावास्यम् नुं उपनिषदोमां स्थान यर्यो।

(१४)

Importance of 'ईशावास्यम्' in Upanishad.

अथवा/OR

'अक्षसूक्त' पर सविस्तार यर्या करो।

Write in detailed note on 'अथसूक्त'

नीयेनामांथी कोईपछा बे पर टूकनोध लघो।

(१४)

१. पर्जन्यसूक्तम्।

२. ईशावास्योपनिषद मां कर्मयोग।

३. अर्थवेद रचनाकालः।

४. विद्या-अविद्या।

647510

BA06EngF601A
B.A. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)
Foundation English (Foundation (New))

Seat No : 669487

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

Que-1 (A) Answer in one sentence:

(08)

1. Who is the author of the speech "Go Kiss the World"?
2. What is our responsibility in this virtual world?
3. What plays a key role in the advancement of the human race?
4. Why torrent bird was silent in the Worker's Paradise?
5. Why does the poet feel strange to stop in the woods?
6. Who is the poet of the poem, "Ecology"?
7. Who suffered from migrane?
8. What is the name of the tree in the poem, "Ecology"?

Que-1 (B) Answer briefly: (any two)

(06)

1. Why is the poet angry in the poem "Ecology"?
2. Who warns the poet for not reaching his destination?
3. How did the man spend his time in Worker's Paradise?

Que-2 Write short notes: (any two)

(14)

1. Message of the poem "Ecology"
2. Theme of the poem "Life"
3. Causes of social isolation.

Que-3 (A) Translate into Gujarati:

(07)

Books are our never failing friends. Our worldly friends desert us, but they never desert us. They are our best friends, philosophers and guides. Friends are plenty when the purse is full but fair weather and friends fall off in adversity. Books, like a true friend stand by us through thick and thin. They show us path when we are sad. Good books enrich our knowledge and make our life happier.

Que-3 (B) Translate into English:

(07)

અત્યારે સજીવ ઘેતી માટે જુંબેશ ચલાવવી પડે છે, બાપુજી માટે આ સહજ જીવનકમ હતો. લોકોને પાંગળા અને પરાવલંબી બનાવટી આજની મેકોલે ભ્રાન્ડ રિસ્ક્ષા પદ્ધતિમાથી બહાર કાઢવા નઇતાલીમની શાળા તો સ્થાપેલી. તે આજના ITI નું પૂર્વરૂપ હતું. બાપુજીની સ્વસ્થતા, ધીર્ય અને અહિસાની કસોટી પુનમની મિટિંગોમાં થતી. ગામડાઓમાં કુંભ-કુંભ વર્ષેના કંકાસ, છૃતાંખૃતના ભેદભાવ, વ્યસનો, વહેમો અને અંધશ્રદ્ધા. આ બધું પુનમ મિટિંગના મુદ્દાઓ હતા. સર્વધર્મ સમભાવ તરફ લોકોને લઈ જવાના હતા. બાપુજી રેટિંગો કાતતા કાતતા 'સ્ટેટે લેજો હરિનું નામ' પદને ગાતા જતાં હતા.

Que-4 (A) Develop the story using the given points and give a suitable title (any one) (07)

1. Points:

A boy -- falls in bad company--the father is disturbed – thinks of teaching a lesson – father brings apples – asks the boy to put them in the cupboard – places a rotten apple among them – next day all apples rotten – the boy is shocked – asks the father – father teaches a lesson – moral of the story.

2. Points:

Old farmer had lazy sons – farmer on dead bed – called all his sons – told them of a treasure – hidden in his field – they dug the field – found nothing – sow the seeds – good crop – earn much – learnt the lesson – conclusion.

Que-4 (B) Write an E-mail:(any one)

(07)

1. Write an email to the State Bank of India of your town requesting the Branch Manager to give you the details for home loan.
2. Write an email to your friend who has just got a job as a teacher. Also give him some advice.

Que-5

Prepare a questionnaire: (any one)

(14)

1. Draft a questionnaire for the customers' popularity of TV.
2. Draft a questionnaire for the survey of living conditions of college girls living in the hostels.

B.A. Semester - 6 (CBCS) Examination
April/May-2022 (NEW COURSE)

Jaydrath Vadh Evam Hindi Bhasha Pravidhi (Foundation (New))

Marks: 70

Time: 2:30 Hours

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

प्रश्न १ मैथिलीशरण गुप्त का व्यक्तित्व एवं कृतित्व लिखिए। (१४)

अथवा

प्रश्न १ 'जयद्रथ-वध' खण्डकाव्य की कथावस्तु अपने शब्दों में लिखिए।

(१४)

प्रश्न २ खण्डकाव्य के लक्षणों के आधार पर 'जयद्रथ-वध' खण्डकाव्य की समीक्षा कीजिए।

अथवा

प्रश्न २ 'जयद्रथ-वध' खण्डकाव्य के आधार पर अर्जुन का चरित्र-चित्रण कीजिए।

(१४)

प्रश्न ३ भावपक्ष एवं कलापक्ष की द्रष्टि से 'जयद्रथ-वध' खण्डकाव्य की समीक्षा कीजिए।

(१४)

अथवा

प्रश्न ३ 'जयद्रथ-वध' खण्डकाव्य में निरूपित विविध समस्याओं पर प्रकाश डालिए।

(१४)

प्रश्न ४ मैथिलीशरण गुप्त ने 'जयद्रथ-वध' खण्डकाव्य में मानवीय मूल्यों की स्थापना की हैं- चर्चा कीजिए।

(१४)

अथवा

प्रश्न ४ किन्हीं दो पर टिप्पणियाँ लिखिए:

१. 'जयद्रथ-वध' खण्डकाव्य में कल्पना एवं इतिहास का समन्वय।
२. 'जयद्रथ-वध' खण्डकाव्य का उद्देश्य।
३. 'जयद्रथ-वध' खण्डकाव्य की आधुनिकता।
४. 'जयद्रथ-वध' खण्डकाव्य की मिथकीयता।

(०७)

प्रश्न ५ (अ) कहानी लिखिए।

एक सुंदर वन- इन्द्र का आगमन- वन का सौदर्य देखना- सूखे पेड पर तोते को देखना- सवाल पूछना- तोते का जवाब- इन्द्र का वरदान- सीख।

अथवा

एक गाँव- गाँव के बाहर रास्ते में एक पत्थर- लोगों का उससे टकराना- किसी का उसे न हटाना- भला-बुरा कहते आगे बढ़ना- एक किसान का आना- पत्थर हटाकर दूर रखना-पत्थर के नीचे रूपयों की थेली-चिठ्ठी- पत्थर हटाने का इनाम-परिणाम- सीख।

(०७)

(ब) आवेदन पत्र लिखिए।

'हिन्दी अनुवादक' पद के लिए अपनी योग्यता एवं अनुभव दर्शाते हुए आवेदन पत्र लिखिए।

अथवा

हिन्दी विषय के अध्यापक पद हेतु आवेदन पत्र लिखिए।
